



PC-1601250502030101 Seat No. \_\_\_\_\_

**M. A. (Sem. III) (CBCS) Examination**

**May / June - 2018**

**Economics**

**(Agriculture Economics : Theories)**

**(New Course)**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

સૂચના : બધા જ પ્રશ્નો ફરજિયાત છે.

૧ ગ્રામીણ કૃષિ અર્થશાસ્ત્રનો અર્થ આપી તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર વિગતવાર સમજાવો. ૧૪

**અથવા**

૧ પરંપરાગત કૃષિક્ષેત્ર તથા તેનું આધુનિકીકરણ સમજાવીને આર્થિક વિકાસમાં કૃષિક્ષેત્રની ભૂમિકા વિગતવાર સમજાવો. ૧૪

૨ જમીન એટલે શું ? તે જણાવીને જમીન ઉપયોગિતા નીતિ તથા જમીન વહેંચણી નીતિનું ટીકાત્મક મૂલ્યાંકન કરો. ૧૪

**અથવા**

૨ નાના અને સીમાંત ખેડૂતોનો અર્થ આપીને તેમની સમસ્યાઓ તથા ઉકેલોની વિગતવાર ચર્ચા કરો. ૧૪

૩ ઉત્પાદન વિધેય એટલે શું ? કૃષિ અર્થશાસ્ત્રના સંદર્ભમાં કૃષિક્ષેત્રે બિનપ્રમાણસર ઉત્પાદનનો નિયમ સમજાવીને નિર્ણયીકરણ સમજાવો. ૧૪

**અથવા**

૩ કિંમત અને ઉત્પાદનનો સંબંધ સમજાવીને પ્રો. ઈઝેકિલનો કોબવેબ સિદ્ધાંત વિગતવાર ચર્ચો. ૧૪

૪ ભારતની કૃષિનીતિનું ટીકાત્મક મૂલ્યાંકન કરો. ૧૪

**અથવા**

૪ કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીનું આગમન, તેના સોપાનો તથા નિભાવપાત્ર કૃષિ વિકાસના પડકારો જણાવો. ૧૪

૫ નીચેનામાંથી કોઈ પણ બે પર નોંધ લખો : ૧૪

- (૧) કૃષિક્ષેત્ર અને ઉદ્યોગક્ષેત્ર વચ્ચેનો સંબંધ
- (૨) કૃષિક્ષેત્રમાં વીજળી અને પાણીની અગત્ય
- (૩) ભારતમાં નીચી કૃષિ ઉત્પાદકતાના કારણો
- (૪) હરિયાણી ક્રાંતિ.

## ENGLISH VERSION

**Instruction :** All questions are compulsory.

- 1 Give the meaning of Rural Agriculture Economics and explain nature and scope of agriculture economics in detail. 14
- OR**
- 1 Explain traditional agriculture and its modernization and explain role of Agri. sector in economic development in detail. 14
- 2 What is Land ? Explain the land use policy and land distribution policy. Evaluate critically. 14
- OR**
- 2 Give meaning of small and marginal farmers. Explain the issues and solutions of small and marginal farmers in detail. 14
- 3 What is Production function ? Explain law of diminishing return and decision making process in detail. 14
- OR**
- 3 Explain the relationship between price and production and give the theory of Cobwebb by Prof. Ezakeil in detail. 14
- 4 Explain critically evolution of Indian Agriculture Policy in detail. 14
- OR**
- 4 Explain the entry of new technology, steps and challenges of sustainable agriculture development in detail. 14
- 5 Give any two answers : 14
- (1) Relationship between Agriculture sector and Industrial sector.
  - (2) Significance of Water and Electricity in Agriculture sector.
  - (3) Causes of Low Agriculture Production
  - (4) Green Revolution.